

PERMANENT MAGNETS LIMITED

B-3, MIDC, Village Mira, Mira Road (East), Thane - 401104. Maharashtra, India

Phone : +91-22-2945 2121 / 6828 5454. Facimile : +91-22-2945 2128

Email : sales@pmlindia.com Website : www.pmlindia.com



January 30, 2020

To,
Corporate Relation Department
The Bombay Stock Exchange Limited
Phiroze Jeejeebhoy Tower,
Dalal Street, Mumbai - 400 001

Dear Sir(s),

Sub: Intimation regarding Publication of Board Meeting Notice

Scrip Code : 504132

Pursuant to Regulation 47 (3) of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, We enclose herewith Newspaper Advertisement published in the Financial Express (English Daily Newspaper) and Damanganga Times (Gujarati Daily Newspaper) both dated January 30, 2020, which intimate about Board Meeting schedule which will be held on Monday, February 10, 2020 to consider, approve and take on record Unaudited Financial Results on Standalone basis for the quarter and Nine months ended on December 31, 2019.

Further as required under Regulation 46 (2) the said notice have also been placed on Company's Website at www.pmlindia.com and the Shareholders may refer to the same for details.

We request you to kindly take the same on record.

Thanking you,

Yours Faithfully,

FOR PERMANENT MAGNETS LIMITED

RACHANA RANE
COMPANY SECRETARY



Regd Office: Harsh Avenue, 302, 3rd Floor, opp. Silvassa Police Station, Silvassa Vapi Main Road,
Silvassa- 396 230. Dadra and Nagar Haveli (U.T.)

(All correspondence has to be made at our Mira Road address only)

CIN-L27100DN1960PLC000371



Indian Bank
Dixit Bungalow, Daxini Society, Nr. Good Luck Hall,
Mandisar Ahmedabad-380008 Phone No. : 079-2546374
Fax: 079-2546922 Email: daxinisociety@indianbank.co.in

"APPENDIX - IV-A" [See proviso to rule 8 (6)]
Sale notice for sale of immovable properties
E-Auction Sale Notice for Sale of Immovable Assets under the
Securitisation and Reconstruction of Financial Assets and
Enforcement of Security Interest Act, 2002 read with proviso to
Rule 8 (6) of the Security Interest (Enforcement) Rules, 2002

Notice is hereby given to the public in general and in particular to the Borrower (s) and Guarantor (s) that the below described immovable property mortgaged/charged to the Secured Creditor, the Symbolic possession of which has been taken by the Authorised Officer of Indian Bank Secured Creditor, will be sold on "As is where is", "As is what is", and "Whatever there is" on 15.02.2020 for recovery of ₹ 9,02,899/- (Nine Lakh Two thousand Eight Hundred Ninety Nine only) as on 28.01.2020 due to the Indian Bank, Secured Creditor from.

1. Mr. Dharmendra Hirshali Trivedi (Borrower & Mortgagor)
11/65, Azad Society, Ambavadi, Ahmedabad

2. Mrs. Chaitali Dharmendra Bhai Trivedi (Co-Borrower)
11/65, Azad Society, Ambavadi, Ahmedabad

3. Mr. Siddharth Laxman Pagare (Guarantor)
F/406, 4th Floor, F-Block, Bhagwat Greens, Near Akruiti Town ship Village/Mouje-Naroli, Taluka-Mandisar, Ahmedabad

The Reserve Price will be ₹ 13.00 lakhs (Thirteen Lakhs only) and the earnest money deposit will be ₹ 1.30 lakhs (One Lakh Thirty thousand only).

Property details:
Flat No. F/406, 4TH Floor scheme known as "Bhagwat Greens" Survey no. 63/2 & 63/5 near Akruiti township Village/Mouje-Naroli, Taluka-Mandisar Ahmedabad.

For detailed terms and conditions of the sale, please refer to the link provided in website www.bankauctions.com. of our e-auction service provider, may contact C1 India Pvt. Ltd. (Contact number: 0124-4302020,21,22,23,24 Mr. Bhavik Pandya, Mobile: 886662937 Email : gjarat@c1india.com & support@bankauctions.com, Website : https://www.bankauctions.com.

Date: 28.01.2020 Authorized Officer,
Place: Ahmedabad Indian Bank

Corporation Bank
(A Premier Public Sector Bank)
Baben Branch : Shop No. 3, 4, 5, Avadh Shopping Complex, Nr. Avadh Lake City, Baben Gam, Tal. Bardoli, Dist. Surat - 394601. Phone : 02622 - 22227, E-mail : cb1843@corpbank.co.in

POSSESSION NOTICE
(For Immovable Property)

Whereas
The undersigned being the authorized officer of the Corporation Bank under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act 2002 (54 of 2002) and in exercise of powers conferred under Section 13(12) read with rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 issued a demand notice dated 23.05.2019 calling upon the Borrower Mr. Jitendrabhai Nanjibhai Vaghamsi and Co - Borrower Mrs. Asmita Jitendrabhai Vaghamsi to repay the amount mentioned in the notice being Rs. 19,43,806/- (Rupees Nineteen Lakhs Forty Three Thousand Eight Hundred Six Only) within 60 days from the said notice.

The Borrower having failed to repay the amount, notice is hereby given to the borrower and the public in general that the undersigned has taken Physical Possession of the property described herein below in exercise of powers conferred on him/her under sub section (4) of section 13 of the said Act read with rule 8 of the Security Interest enforcement act rule 2002, on this the 27th day of January of the year 2020.

The Borrower in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of the Corporation Bank for an amount Rs. 19,43,806/- and interest thereon.

The borrower's attention is invited to provisions of sub-section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.

DESCRIPTION OF THE IMMOVABLE PROPERTY

EMG of Plot No. 155, Shiv Vatika Row House, Revenue Survey No. 60, Block No. 54, Moje Village - Mankana, Taluka - Kamrej, Dist. Surat - 394325. Bounded by - North : Adj. Society Internal Road, South : Adj. Plot No. 148, East : Adj. Plot No. 156, West : Adj. Plot No. 154.

Date : 27.01.2020, Place : Baben Authorized Officer, Corporation Bank

PERMANENT MAGNETS LIMITED
Regd Off: Harsh Avenue, 302, 3rd Floor, Opp. Silvassa Police Station, Silvassa Vapi Main Road, Silvassa - 396230. Dadra and Nagar Haveli (U.T.) CIN: L27100DN1960PLC000371 Website: www.pmlindia.com Email ID: investors@pmlindia.com

NOTICE

Pursuant to Regulation 29 read with Regulation 47 of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, Notice is hereby given that a Meeting of the Board of Directors of the Company will be held on Monday, February 10, 2020 at 8-3, MIDC, Village Mira, Mira Road (East), Thane - 401104 inter alia to consider, approve and take on record the Unaudited Financial Results for the Quarter and Nine months ended on December 31, 2019.

Further, pursuant to our Letter dated December 30, 2019 and in terms of SEBI (Prohibition of Insider Trading) Regulations, 2015 with the Company's internal code of conduct, for prevention of insider Trading, the trading window for dealing in securities of the Company will remain closed for Directors / Officers / Designated persons of the Company till 48 hours post the board meeting i.e till February 12, 2020. The trading window shall reopen on February 13, 2020.

The said Notice can be accessed on the company's website at www.pmlindia.com and on the BSE Limited's website at www.bseindia.com

For Permanent Magnets Ltd
Date: 30-01-2020 (Rachana Rane)
Place: Mira Road Company Secretary

यूको बँक
(भारत सरकार का उपक्रम)

UCO BANK
(A Govt. of India Undertaking)

सम्मान आपके विश्वास का
Honours Your Trust

ASSETS MANAGEMENT BRANCH: 359, Dr. D. N. Road, 4th Floor, Fort, Mumbai-400 001. Ph. No. : (022) 4018 0418 / 419 Fax No. : (022) 2202 1860 E-mail : mumamb@ucobank.co.in

PUBLIC NOTICE FOR E-AUCTION SALE OF IMMOVABLE PROPERTIES

Date Of E-Auction: 18-Feb-2020 | Between 11.00 am to 12.00 noon. As per (IST) with unlimited Extensions of 5 minutes each
Last Date & Time Of Receipt Of EMD (Earnest Money) And Documents: 15-Feb-2020 up to 04.00 PM
Property can be inspected on or before 13-Feb-2020 between 10.00 A.M. IST and 04.00 P.M. IST with prior appointment

E-Auction Sale notice for Sale of Immovable Assets under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 read with Rule 8(6) of the Security Interest (Enforcement) Rules, 2002.

Notice is hereby given to the public in general and in particular to the Borrower(s) and Guarantor(s) that the below described immovable properties mortgaged/charged to UCO Bank, the constructive/physical possession (as specified against each property) of which has been taken by the Authorized Officer of UCO Bank, will be sold on "As is where is", "As is what is", and "Whatever there is" basis on 18-FEB-2020, for recovery of amounts due to UCO Bank from the following Borrower(s)/Guarantor(s). The reserve price and the earnest money deposit amount are as mentioned in the table below.

Sr. No	Name of the Branch and the Borrower	Amount Due	Details of the Property	Reserve Price & Earnest Deposit Amount	Name of the Contact Person and Contact No.
1	Branch AMB Mumbai 2129 Borrower M/S Janta Glass Ltd	Rs. 76,15,13,222.61 (+Interest +costs +charges)	Plot No. 410 & 411 (along with construction) P.O. Gavsad, Taluka- Padra, Distt- Vadodara PIN-381440, Gujarat, New Block No. 410 & 411 in the name of M/S Pure Glass Containers Pvt. Ltd (Area: 45250 sq. mtr.)	Rs. 499.50 lakh Rs. 49.95 lakh	Mr. Basant Kumar Nayak, Assistant General Manager Mob.9062006438 022-40182066

For detailed terms and conditions of the sale, please refer to the link provided in <https://ucobank.auctiontiger.net/or/and.www.ibapi.in>

Intending bidders shall hold a valid digital signature certificate and e-mail address for details with regard to digital signature, please contact M/s. e-Procurement Technologies limited (Auction Tiger) Ahmedabad contact No. 079-40230841/844/805/813/816/818/814. Contact persons : Mr. Tilak Maratha, Mobile No: 09067799646 E-mail : Tilak@auctiontiger.net, Mr. Vijay Shetty, Mobile No. 09619120214, or Maharashtra@auctiontiger.net, Fax No. 079-40230847.

Date: 30-Jan-2020 Authorized Officer
Place: Mumbai

Muthoot Homefin (India) Ltd
Corporate Office : 1201 & 1202, 12th Floor, 'A' Wing, Lotus Corporate Park, Off. Western Express Highway, Goregaon (East), Mumbai - 400 063.

POSSESSION NOTICE
(As per Appendix IV read with rule 8(1) of the Security Interest Enforcement Rules, 2002)

Whereas, the undersigned being the Authorized Officer of the Muthoot Homefin (India) Limited, under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and in exercise of powers conferred under section 13(12) read with rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002, issued a demand notice calling upon the borrower Mr. Mitul Dashrathbhai Bhatt, Mrs. Snehaben Mitulkumar Bhatt., to repay the amount mentioned in the notice dated 22/08/2019, being Rs. 991535/- (Rupees Nine Lac Ninety One Thousand Five Hundred Thirty Five Only) up to 31/07/2019 along with contractual rate of interest plus penal interest @ 24% per annum, charges, costs etc. within 60 days from the date of the said notice.

The borrower, having failed to repay the amount, notice is hereby given to the borrower, in particular and the public, in general, that the undersigned has taken possession of the property described herein below in exercise of powers conferred on him under section 13(4) of the said Act read with rule 6 of the said Rules on this 28th day of January, 2020.

The borrower, in particular, and the public, in general, are hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of the Muthoot Homefin (India) Limited, for an amount of Rs. 991535/- (Rupees Nine Lac Ninety One Thousand Five Hundred Thirty Five Only) along with interest thereon and penal interest @ 24%, charges, costs etc. from 01/08/2019.

The Borrowers attention is invited to the provisions of Sub-Section (8) of Section 13 of the Act in respect of time Available to redeem the secured Assets..

DESCRIPTION OF THE IMMOVABLE PROPERTY

Immovable Properties D/503 Fifth Floor Shivesh 621 Bldg, Village- Lambha, Nr Lambha Temple, Taluka- Dascroi Ahmedabad-382405. More particularly Mentioned in the Sale Deed Registered No. AHD-11-ASL-9353/2018 Dated 29-06-2018 in the office of Sub Registrar Ahmedabad.

Having Boundaries North : Block No. C, **South :** Flat No. D/504, **East :** Open Space, **West :** Flat No. D-502

Date : 28/01/2020 Authorized Officer
Place : Ahmedabad Muthoot Homefin (India) Limited

पंजाब नैशनल बैंक
punjab national bank

Circle Office : Surat : Tulsi Krupa Arcade (4th Floor), Aai Mata Chowk, Surat-Bardoli Road, Surat - 395010 Contact No. : 0261-2701027, 28 email id : csuratrecovery@pnb.co.in

Date of E-Auction - 05.03.2020 (From 11.00 am to 12.00 pm) Date & Time of Inspection : Date 26.02.2020 (Between 10.00 AM to 4.00PM)

SALE NOTICE FOR SALE OF IMMOVABLE PROPERTIES

E-Auction Sale Notice for Sale of Immovable Assets under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 read with proviso to Rule 8 (6) of the Security Interest (Enforcement) Rules, 2002.

Notice is hereby given to the public in general and in particular to the Borrower (s) and Guarantor (s) that the below described immovable property mortgaged/charged to the Secured Creditor, the constructive/physical/ symbolic possession of which has been taken by the Authorised Officer of the Bank/ Secured Creditor, will be sold on "As is where is", "As is what is", and "Whatever there is" on the date as mentioned in the table herein below, for recovery of its dues due to the Bank/ Secured Creditor from the respective borrower (s) and guarantor (s). The reserve price and the earnest money deposit will be as mentioned in the table below against the respective properties

SCHEDULE OF THE SECURED ASSETS

Sr. No.	Name of the Branch	Description of the Immovable Properties Mortgaged/Owner's Name (mortgagors of property(ies))	Authorized Officer	A) Dt. Of Demand Notice u/s 13(2) of SARFESI Act 2002 B) Outstanding Amount as on 31.12.2019 C) Possession Date u/s 13(4) of SARFESI Act 2002 D) Nature of Possession Symbolic / Physical / Constructive	A) Reserve Price (Rs. in Lacs) B) EMD (last date of deposit of EMD) C) Bid Increase Amount	Date/ Time of E-Auction	Details of the encumbrances known to the secured creditors
1	PNB - Bharuch Shri Vinodkumar Subhaschand Bafna, Shri Vinodkumar Subhaschand Bafna Residential Row House at Plot No. B-151, Mangalya Residency, R. S. No./ Block No. 121 and 122 (North Side Eastern land), Near Narmada Claorx School, Moje - Chavaj, Taluka - Bharuch, District - Bharuch (Built up Area : 877.00 sq. ft.) (Owner : Shri Vinodkumar Subhaschand Bafna)	Residential Row House at Plot No. B-151, Mangalya Residency, R. S. No./ Block No. 121 and 122 (North Side Eastern land), Near Narmada Claorx School, Moje - Chavaj, Taluka Bharuch, District Bharuch	Shri Deen Dajal Satija 7043331659	A) 27.09.2018	A) Rs. 20.04 Lac	05/03/2020 From 11.00AM to 12.00 PM Noon (with extension of 10 minutes if necessary)	Not Known
				B) Rs. 47,87,439 + further interest w.e.f. 01.01.2020.	B) Rs 2.00Lac		
				C) 24.07.2019	C) Rs. 0.25 Lac		
				D) Physical			
2	PNB - Navsari, Station Road Shri Mehul Shashikant Shah Shri Mehul Shashikant Shah Residential Flat no. 603, 6th Floor, Building No. A, Navpad Apartment Co Op Society, Beside Arihant Apartment, Shantadevi Road, Navsari (Super Built Up Area : 1146.00 sq. ft.) (Owner: Shri Mehul Shashikant Shah and Smt. Pritiben Mehul Shah)	Residential Flat no. 603, 6th Floor, Building No. A, Navpad Apartment Co Op Society, Beside Arihant Apartment, Shantadevi Road, Navsari	Shri Abid Siddiqui 7043331205	A) 01.08.2018	A) Rs. 18.30 Lac	05/03/2020 From 11.00AM to 12.00 PM Noon (with extension of 10 minutes if necessary)	Not Known
				B) Rs. 15,45,044.46+ further interest w.e.f. 01.01.2020.	B) Rs 1.83 Lac		
				C) 11.01.2019	C) Rs. 0.25 Lac		
				D) Symbolic			
3	PNB - Purnakumbharia Road, Surat Shri Rajesh Revallirana Shri Rajesh Revallirana Residential Gala type property at Plot No.334, Rahi Township, Vibhag 1, Block no. 369, Behind Dwarka Residency, Near Aroya Kendra, Gangadhara Railway Station, Moje, Kareli, Survey No 352,353 and 354, Taluka Plasana, District Surat. (Land Area : 40.15 sq. mt.) (Owner: Shri Rajesh Revallirana)	Residential Gala type property at Plot no. 334, Rahi Township, Vibhag 1, Block no. 369, Behind Dwarka Residency, Near Aroya Kendra, Gangadhara Railway Station, Moje, Kareli, Survey No 352,353 and 354, Taluka Plasana, District Surat.	Shri Bikash Prasad 9993755320	A) 12.07.2018	A) Rs. 12.20 Lac	05/03/2020 From 11.00AM to 12.00 PM Noon (with extension of 10 minutes if necessary)	Not Known
				B) Rs. 9,01,822.00+ further interest w.e.f. 01.01.2020.	B) Rs 1.22Lac		
				C) 24.01.2019	C) Rs. 0.25 Lac		
				D) Symbolic			
4	PNB - Purnakumbharia Road, Surat Shri Ramesh Chenaram Parihar Shri Ramesh Chenaram Parihar Residential Flat No. 103, 1st Floor, Building No. C, MAAKHOYAR Complex, Opposite Salasar Residency, Near Shantanu Residency, Godadara, Tal. Surat City, Dist. Surat (Super Built Up Area : 1017.00 sq. ft.) (Owner: Shri Ramesh Chenaram Parihar) (Symbolic Possession)	Residential Flat No. 103, 1st Floor, Building No. C, MAAKHOYAR Complex, Opposite Salasar Residency, Near Shantanu Residency, Godadara, Tal. Surat City, Dist. Surat	Shri Bikash Prasad 9993755320	A) 01.02.2018	A) Rs. 24.40 Lac	05/03/2020 From 11.00AM to 12.00 PM Noon (with extension of 10 minutes if necessary)	Not Known
				B) Rs. 6,44,077.20+ further interest w.e.f. 01.01.2020.	B) Rs2.44Lac		
				C) 21.05.2019	C) Rs. 0.25 Lac		
				D) Symbolic			
5	PNB - Surat Main M/S Shree Ram Weave Tech Pvt Ltd 1. Shri. Vipul Narorambhai Ramanuj Add: 28, SK Park, Sarthana Village Kathodaria, Tal. Kamrej, Dist. Surat- 394326 2. Shri Mitul Devjibhai Vagasiya Add: A/1, Flat No. 303, Girraj Apartment Sector-2, Vrajbhumi Township, Nr. VrajChowk, SarthanaJakt Naka, Simada Gam, Surat- 394210.	Open Land (101 Plots) i.e. Plot No. 57, A/59, 60, 61, 62, 68, 69, 72, 73, A/73, 74, 75, 76, 77, 78, 79, 80, 80/A, 81, 82, 83, 84, 85, 86, 87, A/87, 88, 89, 90, 91, 92, 93, 94, A/94, 95, A/95, D-1/14, D-1/15, D/437, A/438, 438, 493, A/493, B/493, D/16, 494, 495, 496, 497, A/497, 498, 499, 500, 501, 502, 503, 504, 513, 514, 515, A/172, 173, 174, 175, 176, 177, 182, 183, 184, 185, 186, A/186, 187, 188, 189, 190, 191, 192, 193, A/193, B/193, D-1/06, D-1/07, D/326, A/327, B/327, 327, 328, 379, 380, 381, B/181, A/181, G/221, H/221, I/221, J/221, K/221, L/221, 246 & 249. Makhdrov Nagar, R.S. No. 94/2-36, 177/8-25, Block No. 98, Moje: Kothwa, Sub Distt. Mangrol, Distt. Surat. (Total Area- 56,557.70 Sq. Ft.) (Owner-Vipulbhai Narotambhai Ramanuj and Mitul Devjibhai Vaghashiya)	Shri Sunil Kumar Lekh 7043331201	A) 12.10.2013	A) Rs. 95.52 Lac	05/03/2020 From 11.00AM to 12.00 PM Noon (with extension of 10 minutes if necessary)	Not Known
				B) Rs. 4,56,42,177.00+ further interest w.e.f. 01.01.2020.	B) Rs9.55Lac		
				C) 14.02.2014	C) Rs. 0.25 Lac		
				D) Physical			

ADITYA BIRLA ADITYA BIRLA HOUSING FINANCE LTD.
Registered Office: Indian Rayon Compound, Veraval, Gujarat 362206. Branch Office: Aditya Birla Housing Finance Limited at 802, 8th Floor, Samudra Annexe, Off C/G Road, Nr. Saffron Hotel, Nr. Girish Coldrink, Ahmedabad-380009 Contact Nos. ABHFL AO Mr. Siddharth Kotadia and Mobile Nos. 9824909590

ANNEXURE 6: Demand Notice under section 13(2) of SARFESI Act, 2002 (herein after as the said "Act")

To:
1. MR. Nareish Rameshchandra Rothera, Ramesh Biscuit Company, Bh MD High School, Sajpur Bogha. Naroda Road, Sajpur Bogha, Krishnanagar S.O., Ahmedabad, Gujrat (India)-382345.

Also At
Plot No 46 B/H.M.D High School, Opp Rama Hall Sajpur Bogha, Ahmedabad Krishnanagar S.O., Ahmedabad, Gujrat (India)-382345

Also At
Flat No C/9, 9TH Floor, Satya Triveni Tower, Satya Triveni CHSL, Opp. Parkhill Bunglows, Nr. Satby Hospital, Ramdevnagar Road, Satellite, Ahmedabad, Gujrat (India)-380015. (Survey No 985/2, FPN No. 143)

2. Mrs. Divya Nareishbhai Rothera
Ramesh Biscuit Company, Bh MD High School, Sajpur Bogha. Naroda Road, Sajpur Bogha, Krishnanagar S.O., Ahmedabad, Gujrat (India)-382345.

Also At
Plot No 46 B/H.M.D High School, Opp Rama Hall Sajpur Bogha, Ahmedabad Krishnanagar S.O., Ahmedabad, Gujrat (India)-382345

Also At
Flat No C/9, 9TH Floor, Satya Triveni Tower, Satya Triveni CHSL, Opp. Parkhill Bunglows, Nr. Satby Hospital, Ramdevnagar Road, Satellite, Ahmedabad, Gujrat (India)-380015. (Survey No 985/2, FPN No. 143)

3. Mrs. Pearl Foods,
Plot No 46 B/H.M.D High School, Opp Rama Hall Sajpur Bogha, Ahmedabad Krishnanagar S.O., Ahmedabad, Gujrat (India)-382345

Also At
Ramesh Biscuit Company, Bh MD High School, Sajpur Bogha. Naroda Road, Sajpur Bogha, Krishnanagar S.O., Ahmedabad, Gujrat (India)-382345

4. Mrs. Shobhavati Rameshchandra Rothera
Ramesh Biscuit Company, Bh MD High School, Sajpur Bogha. Naroda Road, Sajpur Bogha, Krishnanagar S.O., Ahmedabad, Gujrat (India)-382345.

Also At
Plot No 46 B/H.M.D High School, Opp Rama Hall Sajpur Bogha, Ahmedabad Krishnanagar S.O., Ahmedabad, Gujrat (India)-382345

Also At
Flat No C/9, 9TH Floor, Satya Triveni Tower, Satya Triveni CHSL, Opp. Parkhill Bunglows, Nr. Satby Hospital, Ramdevnagar Road, Satellite, Ahmedabad, Gujrat (India)-380015. (Survey No 985/2, FPN No. 143)

Re : Loan, Loan Account No. LNAHMHL - 10170032829 for an amount of Rs. 1,02,50,000/- (Rupee One Crore Two Lakh Fifty Thousand Only). And Loan Account No. LNAHMHL - 10170030322 for an amount of Rs. 3,68,000/- (Rupees Three Lakh Sixty Eight Thousand Only)

Whereas Aditya Birla Housing Finance Limited, a Company incorporated under the Companies Act, 1956, having its registered office at Indian Rayon Compound, Veraval, Gujarat 362 206 having one of its offices at 802, 8th Floor, Samudra Annexe, Off C/G Road, Nr.Saffron Hotel, Nr. Girish Coldrink, Ahmedabad - 380009 (hereinafter referred as "ABHFL") had extended credit facility to you, the Addressee. The said credit facility is secured inter alia by way of mortgage over the immovable property being C/9, 9TH Floor, Satya Triveni Tower, Satya Triveni CHSL, Opp. Parkhill Bunglows, Nr. Satby Hospital, Ramdevnagar Road, Satellite, Ahmedabad, Gujrat (India)-380015. (Survey No 985/2, FPN No. 143) (Herein referred to as "Property").

That you, the Addressee have failed to maintain financial discipline in the loan account as mentioned above and as per the books of accounts maintained in the ordinary course of business by ABHFL, there exists an outstanding amount of Rs. 1,02,50,029.58/- (Rupee One Crore Two Lakh Ninety Six Thousand Twenty Nine & Fifty Eight Paise Only) And Rs. 3,74,872.03/- (Rupees Three Lakh Seventy Four Thousand Eight Hundred Seventy Two & Three Paise Only), arrears (including accrued late charges) and interest till 6th January, 2020. In addition to the said outstanding dues, you are also liable to pay interest and penal interests and/or other charges due in future till the entire outstanding dues are paid. Due to persistent default on the part of you the addressee the loan account has been classified by ABHFL as Non-Performing Asset on 12th December, 2019 within the norms stipulated by the Reserve Bank of India.

In view of the above default, ABHFL hereby calls upon you the addressee to discharge in full your liabilities towards ABHFL by making the payment of the entire outstanding dues including up to date interest, costs, and charges within 60 (sixty) days from the date of publication of this notice, failing which, ABHFL shall be entitled to take possession of the Secured Asset and shall also take other actions as available to ABHFL, in law.

This notice is informed that you are hereby restrained from alienating (including by way of transfer, sale, lease or otherwise) or creating third party interest or dealing with the secured asset in any manner except with specific prior written permission from ABHFL. Be informed that any contravention thereof shall be punishable with imprisonment upto a period of one year or with fine or both.

That please note that this is a final notice under Section 13(2) of the Securitization And Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002. Needless to say that ABHFL shall be within its right to exercise any or all of the rights referred to above against you the Addressee entirely at your risk, responsibility and costs.

Place : Ahmedabad
Dated : 30 January 2020 Aditya Birla Housing Finance Limited Authorized Officer

TERMS AND CONDITIONS OF E-AUCTION SALE

1. The sale shall be subject to the Terms & Conditions prescribed in the Security Interest (Enforcement) Rules 2002 and to the following further conditions. (1) The auction sale will be "online through e-auction" portal <http://www.mstcecommerce.com> / 2. The intending Bidders/ Purchasers are requested to register on portal (<https://www.mstcauction.com>) using their mobile number and email-id. Further, they are requested to upload requisite KYC documents. Once the KYC documents are verified by e-auction service provider (may take 2 working days), the intending Bidders/ Purchasers has to transfer the EMD amount using online mode in his Global EMD Wallet by 03.03.2020 by 4.00 PM before the E-Auction Date and time in the portal. The registration, verification of KYC documents and transfer of EMD in wallet must be completed well in advance, before auction. 3. Earnest Money Deposit (EMD) amount as mentioned above shall be paid online through 3 mode i.e. NEFT/ Cash/ Transfer (After generation of Challan from <https://www.mstcecommerce.com>) in bidders Global EMD Wallet. NEFT transfer can be done from any Scheduled Commercial Bank, however for Cash/ Transfer the bidder has to visit Punjab National Bank Branch. Payment of EMD by any other mode such as Cheques will not be accepted. Bidders, not depositing the required EMD online, will not be allowed to participate in the e-auction. The Earnest Money Deposited shall not bear any interest. 4. Platform (<https://www.mstcecommerce.com>) for e-Auction will be provided by e-auction service provider M/S MSTC Limited having its Registered office at 225-C, A.J.C. Bose Road, Kolkata-700020 (contact Phone & Toll free Numbers 079-41072412/ 411/ 413 or 1800-103-5342). The intending Bidders/ Purchasers are required to participate in the e-Auction process at e-Auction Service Provider's website <https://www.mstcecommerce.com>. This Service Provider will also provide online demonstration/ training on e-Auction on the portal. 5. The Sale Notice containing the General Terms and Conditions of Sale is available / published in the following websites/ web page portal. (1) <https://www.ibapi.in> (2) <https://eprocure.gov.in/epublish/app/3/> (<https://www.mstcecommerce.com/>) (4) www.pnbindia.in, 6. The intending participants of e-auction may download free of cost, copies of the Sale Notice, Terms & Conditions of e-auction, Help Manual on operational part of e-Auction related to this e-Auction from e-BIKRI -IBAPI portal (<https://www.ibapi.in>). 7. The intending Bidders/ Purchasers are requested to register on portal (<https://www.mstcauction.com>) using their mobile number and email-id. Further, they will upload the requisite KYC documents. Once the KYC documents are verified by e-auction service provider (may take 2 working days), the intending Bidders/Purchasers has to transfer the EMD amount using online mode in his Global EMD Wallet. Only after having sufficient EMD in his wallet, the interest bidder will be able to bid on the date of e-auction. 8. Bidder's Global Wallet should have sufficient balance (>=EMD amount) at the time of bidding. 9. During the e-auction bidders will be allowed to offer higher bid in inter-se bidding over and above the last bid quoted and the minimum increase in the bid amount must be of Rs. 25,000/- to the last higher bid of the bidders. Ten minutes time will be allowed to bidders to quote successive higher bid and if no higher bid is offered by any bidder after the expiry of ten minutes to the last highest bid, the e-auction shall be closed. 10. It is the responsibility of intending Bidder(s) to properly read the Sale Notice, Terms & conditions of e-auction, Help Manual on operational part of e-Auction and follow them strictly. (1) In case of any difficulty or need of assistance before or during e-Auction process may contact authorized representative of our e-Auction Service Provider (<https://www.mstcecommerce.com/>) Details of which are available on the e-Auction portal. 11. After finalization of e-Auction by the Authorized Officer, any successful bidder will be informed by our above referred service provider through SMS/ email. (On mobile no/ email address given by them/ registered with the service provider). 12. The secured asset will not be sold below the reserve price. 13. The successful bidder shall have to deposit 25% (twenty five percent) of the bid amount, less EMD amount deposited, on the same day or not later than the next working day and the remaining amount shall be paid within 15 days from the date of auction in the form of Banker's Cheque/ Demand Draft issued by a Scheduled Commercial Bank in favor of "The Authorized Officer, Punjab National Bank, A/C (Name of the A/C) Payable at In case of failure to deposit the amounts as above within the stipulated time, the amount deposited by successful bidder will be forfeited to the Bank and Authorized Officer shall have the liberty to conduct a fresh auction/ sale of the property & the defaulting bidder shall not have any claim over the forfeited amount and the property. 14. Payment of sale consideration by the successful bidder to the bank will be subject to TDS under Section 194-1A of Income Tax Act 1961 and TDS is to be made by the successful bidder only at the time of deposit of remaining 75 % of the bid amount/full deposit of BID amount. 15. The Authorized Officer reserves the right to accept any or reject all bids, if not found acceptable or to postpone/cancel/adjourn/discontinue or vary the terms of the auction at any time without assigning any reason whatsoever and his decision in this regard shall be final. 16. The sale certificate shall be issued in the favor of successful bidder on deposit of full bid amount as per the provisions of the act. 17. The properties are being sold on "AS IS WHERE IS BASIS" and "AS IS WHAT IS BASIS" and "WHATSOEVER THERE IS BASIS" 18. The particulars of Secured Assets specified in the Schedule hereinabove have been stated to the best of the information of the Authorized Officer, but the Authorized Officer shall not be answerable for any error, misstatement or omission in this proclamation. 19. It shall be the responsibility of the bidders to inspect and satisfy themselves about the asset and specification before submitting the bid. The bidder inspect the property in consultation with the dealing official as per the details provide. 20. All statutory dues/attendances/charges/other dues including registration charges, stamp duty, taxes etc. shall have to be borne by the purchaser. 21. The Authorized Officer or the Bank shall not be responsible for any charge, lien, encumbrances, or any other dues to the Government or anyone else in respect of properties (E-Auctioned) not known to the bank. The Intending Bidder is advised to make their own independent inquiries regarding the encumbrances on the property including statutory liabilities, arrears of property tax, electricity dues etc. 22. The bidder should ensure proper internet connectivity, power back-up etc. The Bank shall not be liable for any disruption due to internet failure, power failure or technical reasons or reasons/contingencies affecting the e-auctions. 23. It is open to the Bank to appoint a representative and make self bid and participate in the auction. 24. The Sale will be done by the undersigned through e-auction platform provided at the Website <https://www.mstcecommerce.com> on 05.03.2020 @ 11.00 AM. 25. In case of any objection, representation or any other correspondence related to the IP put on auction, please contact or write to the responsible Authorized Officer as mentioned in front of respective property. 26. For detailed term and conditions of the sale, please refer www.ibapi.in, www.tenders.gov.in, www.mstcecommerce.com, <https://eprocure.gov.in/epublish/app>.

STATUTORY SALE NOTICE UNDER RULE 8(6) OF THE SARFESI ACT, 2002

Date: 30.01.2020 | Place: Surat Authorized Officer, Punjab National Bank

અગ્રણીઓએ ફૂલો થી સન્માન કર્યું
બીલીમોરા-ગણદેવીમાં ભારત બંધને મિશ્ર પ્રતિસાદ



બીલીમોરા, તા.૨૮ : ગણદેવી તાલુકામાં સીએએ અને એનઆરસીના વિરોધનો મિશ્ર પ્રતિસાદ જોવાનો હતો. લઘુમતી સમાજના કેટલાક લોકોએ સ્વયંભૂ સજ્જડ બંધ પાડ્યો હતો. ભારત બંધને સમર્થન આપનારાઓ વિરુદ્ધ સોશિયલ મીડિયામાં ઉદ્દેશીજનક મેસેજો ફરતા કરાતા ચક્રાવર્ય મંચી હતી. જ્યારે વેપાર, ધંધા ચાલુ રાખનારાઓ નું ભાજપ અગ્રણીઓએ ફૂલો આપી સન્માન કર્યું હતું. દેશના કેટલાક ભાગમાં નાગરિકતા સંશોધન કાયદો (સીએએ)ને નેશનલ રાષ્ટ્રવિરોધી ગણાવવાની (એનઆરસી) કાયદાના વિરોધમાં આંદોલન- પ્રદર્શન ચાલી રહ્યા છે. આ કાયદાઓથી લઘુમતી સમાજ માં અંધા ભરી લાગણી જોવાઈ રહી છે. સરકારના લાખ દાવાઓ છતાં

કાયદાઓ અંગે ભ્રમણા ઓ વ્યાપી રહી છે. જેને પગલે અવિશ્વાસનું વાતાવરણ ઊભું થયું છે. પરિણામે બુધવારે ભારત બંધનું એલાન અપાયું હતું. જેમાં તાલુકામાં લઘુમતી સમાજના કેટલાક લોકોએ સ્વયંભૂ સજ્જડ બંધ પાડ્યો હતો. જેમાં હોટલો, બુટ-ચૉપલ, કપડા, કટલરી, મોબાઇલ, ચાહવાળા, મટન, ચીકન, ઈંગ્રી સેન્ટરના ધંધાબંધોએ બંધ પાડ્યો હતો. તે સિવાય બંધની કોઈ અસર જોવાઈ ન હતી. પરિણામે બંધની સામાન્ય જનતા ઉપર કોઈ અસર વર્તાઈ નહોતી. કારણ કે મોટાભાગના લોકો બંધમાં જોડાયા ન હતા. અને જનજીવન શાંતિપૂર્ણ ધમકું રહ્યું હતું. ભારત બંધ પાડીને ધંધા-રોજગાર બંધ રાખનારાઓ વિરુદ્ધ સોશિયલ મીડિયામાં ઉદ્દેશીજનક મેસેજો ફરતા કરી

Advertisement for Nilkamal Limited featuring a table with columns for 'શ્રેણી', 'નવા મહિના સમગ્રગણો', 'ગત વર્ષના સમગ્રગણો', 'સાલુ નિર્માણિક સમગ્રગણો', and 'નવા મહિના સમગ્રગણો'.

Advertisement for E-Z Clean Car Wash featuring a van and text: 'DOOR TO DOOR SERVICE', 'E-Z Clean CAR WASH', 'INTERIOR & EXTERIOR', 'OUR SERVICES', 'HOME SERVICE OFFICE, SOFA & CARPET CLEANING'.

Advertisement for Permanent Magnets Limited with text: 'PERMANENT MAGNETS LIMITED', 'Regd. Off: Harsh Avenue, 302, 3rd Floor, Opp. Silvassa Police Station, Silvassa Vapi'.

Advertisement for a car wash service with text: 'મે. ઉમરગામનાં જુ. મેજા (ક.ક.) સાહેબની કોર્ટમાં', 'અરજદાર : કુંકુબેન શંકરભાઈ માછી', 'સામાવાળા : જન્મ-મરણ નોંધણી અધિકારી મરોલી'.

Advertisement for Durgam Travels with text: 'મહાકાલી જ્યોતિષ, વાપી-મ. : 9978243825', 'કેમીલીવાળા પેટી દર પેટી સેવા આપતા મહારાજ...', 'દક્ષિણ ગુજરાતનાં જુવાન અને જાણીતાં કારણ શું? નિરાકરણ માટે મળો.'

Advertisement for Bata shoes with text: 'SALE 50% OFF', 'ફૂલ વેરાયટીઓ પર મેળવા', 'બુબરદસ્ત ડિસ્કાઉન્ટ SALE', 'સેલ. સેલ. સેલ. સેલ.'

શકતભાજી માર્કેટ, જ્યોતિષ નીચે, વલસાડ ફોન: 241042

Advertisement for 'જાહેર નોટીસ' (Public Notice) regarding a share certificate, with text: 'જાહેર નોટીસ', 'સબ ડીવીડેન્ડ મેજસ્ટ્રેટશ્રી ધરમપુરની કોર્ટમાં'.

Advertisement for 'જાહેર નોટીસ' (Public Notice) regarding a share certificate, with text: 'જાહેર નોટીસ', 'સબ ડીવીડેન્ડ મેજસ્ટ્રેટશ્રી ધરમપુરની કોર્ટમાં'.

Advertisement for 'જાહેર નોટીસ' (Public Notice) regarding a share certificate, with text: 'જાહેર નોટીસ', 'સબ ડીવીડેન્ડ મેજસ્ટ્રેટશ્રી ધરમપુરની કોર્ટમાં'.

Advertisement for 'જાહેર નોટીસ' (Public Notice) regarding a share certificate, with text: 'જાહેર નોટીસ', 'સબ ડીવીડેન્ડ મેજસ્ટ્રેટશ્રી ધરમપુરની કોર્ટમાં'.

Advertisement for 'જાહેર નોટીસ' (Public Notice) regarding a share certificate, with text: 'જાહેર નોટીસ', 'સબ ડીવીડેન્ડ મેજસ્ટ્રેટશ્રી ધરમપુરની કોર્ટમાં'.

Advertisement for 'જાહેર નોટીસ' (Public Notice) regarding a share certificate, with text: 'જાહેર નોટીસ', 'સબ ડીવીડેન્ડ મેજસ્ટ્રેટશ્રી ધરમપુરની કોર્ટમાં'.

Advertisement for 'જાહેર નોટીસ' (Public Notice) regarding a share certificate, with text: 'જાહેર નોટીસ', 'સબ ડીવીડેન્ડ મેજસ્ટ્રેટશ્રી ધરમપુરની કોર્ટમાં'.

Advertisement for 'જાહેર નોટીસ' (Public Notice) regarding a share certificate, with text: 'જાહેર નોટીસ', 'સબ ડીવીડેન્ડ મેજસ્ટ્રેટશ્રી ધરમપુરની કોર્ટમાં'.

Advertisement for 'જાહેર નોટીસ' (Public Notice) regarding a share certificate, with text: 'જાહેર નોટીસ', 'સબ ડીવીડેન્ડ મેજસ્ટ્રેટશ્રી ધરમપુરની કોર્ટમાં'.

શકતભાજી માર્કેટ, જ્યોતિષ નીચે, વલસાડ ફોન: 241042